

જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૧૧/૨૦૧૭ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી :-

સમાચાર યાદી નં.૨૨૭૫/૧૭

કાઇમબ્રાન્ચ :-

ઘરફોડ ચોરીના જુદા જુદા નવ ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમોને સોના ચાંદીના દાગીના કિ.રૂ.૭૪,૦૨૯/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ

સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથામદદનીશ પોલીસ કમિશનર શ્રી એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ મીલકત સબંધી બનેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરી કરવા સારું આપેલ સુચના મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં એસ.ઓ.જી.ના પોસ્ટ શ્રી વી.એચ.જાડેજા તથા પો.સ.ઇ.શ્રી એમ.કે.ઝાલા નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પો.કો.જીતેન્દ્રકુમાર ત્રિકમલાલ તથા પો.કો. કેતન રાજેન્દ્રકુમાર નાઓએ આપેલ બાતમી હકીકત આધારે ઇસનપુર ચાર રસ્તા પાસેથી આરોપીઓ (૧) મોહમદબિલાલ નઝીરભાઇ શેખ ઉવ.૨૦ ધંધો: મજૂરી રહે, મ.નં.૧૫૦૩/૯, અમીનાબીબીની ચાલી, રસુલાબાદ, શાહઆલમ, અમદાવાદ શહેર (૨) ઇરફાન ઉર્ફે યુહા s/o મોહમદહુસેન શેખ ઉવ.૧૯ ધંધો: મજૂરી રહે, આયશા મસ્જીદની પાસે, જુહાપુર, અમદાવાદ શહેર નાઓને સોના ચાંદીના દાગીના સાથે ઝડપી લેવામાં આવેલ. જેઓની પાસેથી સોના ચાંદીના દાગીના કિ.રૂ.૭૪,૦૨૯/- નો મુદ્દામાલ મળી આવેલ જે પંચનામાં વિગતે કબ્જે કરવામાં આવેલ છે અને સદરી ઇસમને આજરોજ તા.૧૦/૧૧/૨૦૧૭ ના કલાક ૧૫/૩૦ વાગે સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરવામાં આવેલ છે. જેઓની બંને આરોપીઓની પુછપરછ કરતાં નીચે મુજબના ગુના કરેલ છે

(૧) આજથી દસેક મહીના પહેલા બંને જણા રાત્રીના સમયે નવાબ રેસીડેન્સી શાહઆલમ ખાતે એક મકાન બંધ હોય તે મકાનની બારીનો કાચ તોડી બારી ખોલી મકાન પ્રવેશ કરી મકાનમાં તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલ

(૨) તેના વીસેક દિવસ પહેલાં નવાબ રેસીડેન્સીમાં મન.૧૦૪ માં પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ

(૩) ઉપરોક્ત ચોરી કર્યાના સમયમાં નવાબ રેસીડેન્સીના મ.નં.૧૦૬ માં મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ

- (૪) ઉપરોક્ત ચોરી કર્યાના સમયમાં નવાબ રેસીડેન્સીના બીજા માળે મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ
- (૫) આજથી આશરે અગિયાર માસ અગાઉ રાત્રીના સમયે લાલા કોમ્પલેક્ષ શાહઆલમ ખાતે એક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ.
- (૬) આજથી આશરે ત્રણેક માસ અગાઉ રાત્રીના સમયે પાલનપુર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાં એક ભાઈ સુતા હોય જેઓના પોકેટમાંથી રૂપિયા ૧૫,૦૦૦/- તથા એક ઓપો કંપનીનો મોબાઇલની ચોરી કરેલ.
- (૭) આજથી દસેક માસ અગાઉ બપોરના સમયે ક્લાસીક સન્ની ફ્લેટ દાણીલીમડા ખાતે મકાન બંધ હોય તેની બારીના કાચ તોડી બારી ખોલી મકાનમાં પ્રવેશ કરી તીજોરીનું લોક તોડી તેમાંથી એક કાનની બુટ્ટી તેમજ રૂપ૦૦૦ ની ચોરી કરેલ
- (૮) આજથી છ મહીના પહેલાં ઇસનપુર મિલ્લતનગરની સામે ફેઝા કોમ્પલેક્ષમાં પહેલા તથા બીજા માળે આવેલ મકાનોમાંથી સેમસંગ જે-૭ મોબાઇલ ફોન તથા આઇફોન -૫ ની ચોરી કરેલ
- (૯) આજથી સાતેક મહીના પહેલાં સવારના સમયે ઇસનપુર સોનીના ખેતર સામે આવેલ મકાનના પહેલાં માળેથી રૂ.૫૫૦૦ ની ચોરી કરેલાની હકીકત જણાવેલ.

જે બાબતે તપાસ કરતાં (૧) ઇસનપુર પોસ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૧/૧૬ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૨) ઇસનપુર પોસ્ટે.ફ.ગુ.ર.નં.૦૨/૧૭ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૩) ઇસનપુર પોસ્ટે.ફ.ગુ.ર.નં.૨૩/૧૭ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૪) પશ્ચિમ રેલ્વે પાલનપુર રેલ્વે પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૧/૧૭ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાઓ દાખલ થયેલ છે જેથી આરોપીઓને ઇસનપુર પોલીસ સ્ટેશન તરફ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.